

એમપીએસઇએડ યુટિલિટીઝ લિમિટેડ

રજી. ઓફિસ: અદાણી કોર્પોરેટ હાઉસ, શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ.જી. હાઇવે, ખોડિયાર, અમદાવાદ-૩૮૨ ૪૨૧.

નિમ્નલિખિત માટે અરજી નં.૨૪૩૦/૨૦૨૪નો સારાંશ (i) ના.વ. ૨૦૨૩-૨૪નું ટુ-અપ અને (ii) ના.વ. ૨૦૨૫-૨૬થી ના.વ. ૨૦૨૬-૩૦ સુધીના સમયગાળા માટે આવશ્યક એકત્રિત મહેસૂલની મંજૂરી અને ના.વ. ૨૦૨૫-૨૬ માટે દરસૂચિનું નિશ્ચિતીકરણ.

પશ્ચાદભૂમિકાની માહિતી:

- એમપીએસઇએડ યુટિલિટીઝ લિમિટેડ (એમયુએલ) ૧૯૫૬ની જોગવાઈઓ હેઠળ ૨૦૦૮માં નોંધાયેલી કંપની છે. એમયુએલ મુંદ્રા વિસ્તારમાં વિતરણ પરવાનેદાર તરીકે વીજળીના વિતરણના કારોબારમાં પ્રવૃત્ત છે.
- એમયુએલે નિમ્નલિખિત માટે નામદાર ગુજરાત વિદ્યુત નિયમન આયોગ સમક્ષ અરજી દાખલ કરી છે: (i) જીઈઆરસી (એમવાયટી) નિયમન ૨૦૧૬ અનુસાર ના.વ. ૨૦૨૩-૨૪નું ટુ-અપ અને (ii) જીઈઆરસી (એમવાયટી) નિયમન અનુસાર ના.વ. ૨૦૨૫-૨૬થી ના.વ. ૨૦૨૬-૩૦ સુધીના ૪થા નિયંત્રિત સમયગાળા માટે આવશ્યક સંકલિત મહેસૂલને મંજૂરી અને ના.વ. ૨૦૨૫-૨૬ માટે દરસૂચિનું નિશ્ચિતીકરણ.

ના.વ. ૨૦૨૩-૨૪ માટેનું ટુ અપ

- અરજદારે તેની કેસ નં. ૨૧૭૭-૨૦૨૩ દેહળની ટેરિફ અરજીમાં ના.વ. ૨૦૨૩-૨૪ માટેના અંદાજો રજૂ કર્યા હતા અને તે મુજબ નામદાર આયોગ દ્વારા પોતાના તારીખ ૩૧.૦૩.૨૦૨૩ના આદેશ અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટેના એઆરઆરને બહાલી આપવામાં આવી હતી.
- અરજદારે આ અરજીમાં ઓડિટ કરાયેલા હિસાબોના આધારે ના.વ. ૨૦૨૩-૨૪ની ટુ અપ માટેની વિગતો રજૂ કરી છે.
- એમવાયટી નિયમનો, ૨૦૧૬ અનુસાર વાસ્તવિક ખર્ચ અને તેની સામે બહાલી અપાયેલા ખર્ચને ધ્યાનમાં લઈને, અરજદારે એઆરઆરનું ટુ અપ કર્યું છે, નિયંત્રણ હેઠળના તેમજ નિયંત્રણ બહારના માપદંડોના આધારે નફા અને નુકશાનની ગણતરી કરી છે.
- અરજદાર દ્વારા પોતાના પરવાના વિસ્તારમાં ના.વ. ૨૦૨૩-૨૪ માટે કરાયેલું વેચાણ ૬૫૭.૨૩ એમયુ છે. વિતરણ નુકશાન ના.વ. ૨૦૨૩-૨૪ માટે ૩.૨૧%ના અંદાજો સામે ૨.૬૧% થયું છે. જ્યારે વહન નુકશાન ના.વ. ૨૦૨૩-૨૪ માટે અંદાજિત ૧.૦૧% સામે ૦.૬૩% રહ્યું છે. તે મુજબ, ના.વ. ૨૦૨૩-૨૪ માટે ઉર્જાનું સરવૈયું વાસ્તવિક વેચાણો તથા વાસ્તવિક ટી એન્ડ ડીના નુકશાનને આધારે રજૂ કરાયું છે.
- એમયુએલ દ્વારા આ નફો/નુકશાનમાં દિસ્સાની વહેંચણી પછી ના.વ. ૨૦૨૩-૨૪ માટે વસૂલ કરવા પાત્ર ટુ અપ કરાયેલા એઆરઆરની સમરી અહીં નીચે દર્શાવવામાં આવી છે.

કોષ્ટક ૧: ના.વ. ૨૦૨૩-૨૪ માટે ટ્રુ અપ કરાયેલી એઆરઆર

(રૂ. કરોડમાં)

વિગતો		વાસ્તવિક
ના.વ. ૨૦૨૩-૨૪ માટે એમટીઆર આદેશમાં મંજૂર કરાયેલી એઆરઆર	(એ)	૧,૫૪૭.૯૭
બાદ: નિયંત્રણ થઈ શકે તેવા પરિબલોના આધારે થયેલી નફો/(નુકશાન) ગ્રાહકો સાથે વહેંચવાના (૧/૩)	(બી)	-
બાદ: નિયંત્રણ થઈ શકે નહીં તેવા પરિબલોના આધારે થયેલો નફો/(નુકશાન) ગ્રાહકો સાથે વહેંચવાના	(સી)	૧,૨૧૦.૦૨
ના.વ. ૨૦૨૩-૨૪ માટેના ટ્રુ અપ કરાયેલી એઆરઆર	ડી=એ- (બી+સી)	૩૩૭.૯૫

- ના.વ. ૨૦૨૩-૨૪ માટે નફો અને નુકશાનની વહેંચણી કર્યા પછીના ટ્રુ અપ કરાયેલી એઆરઆર રૂ. ૩૩૭.૯૫ કરોડ છે, જ્યારે વીજળીના વેચાણમાંથી થયેલી મહેસૂલી આવક ના.વ. ૨૦૨૩-૨૪ માટે રૂ. ૩૭૮.૩૦ કરોડની છે. આ રીતે. ના.વ. ૨૦૨૩-૨૪ માટેની મહેસૂલી પુરાંત રૂ. ૪૦.૩૫ કરોડ થાય છે.
- નામદાર આયોગ તેના દરસૂચિના આદેશ તારીખ ૩૧.૦૩.૨૦૨૩ અનુસાર રૂ. ૮.૯૫ કરોડના સંકલિત મહેસૂલ સરપ્લસ અને રૂ. (-)૧.૫૪ કરોડના હોલ્ડિંગ ખર્ચને મંજૂરી આપી છે. તે અનુસાર અરજદાર દ્વારા તેને ધ્યાનમાં લેવાયું છે.
- અગાઉના વર્ષોની મંજૂર કરવામાં આવેલા તફાવત સહિત ના.વ. ૨૦૨૩-૨૪ માટેની કુલ મહેસૂલી ખાધ/(પુરાંત) અને તે આગળ લઈ જવાના ખર્ચ (કેરીઇંગ કોસ્ટ) સહિત અહીં નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની છે:

કોષ્ટક ૨: ના.વ. ૨૦૨૩-૨૪ માટેની સંકલિત મહેસૂલી ખાધ/(પુરાંત)

(રૂ. કરોડમાં)

વિગતો	વાસ્તવિક
ના.વ. ૨૦૨૩-૨૪ માટેની ચોખ્ખી મહેસૂલી ખાધ/(પુરાંત)	(૪૦.૩૫)
ઉમેરો: ના.વ. ૨૦૨૧-૨૨ માટેની મંજૂર થયેલી સંકલિત મહેસૂલી ખાધ/(પુરાંત)	(૮.૯૫)
ઉમેરો: ના.વ. ૨૦૨૧-૨૨ની મહેસૂલી ખાધ ના.વ. ૨૦૨૨-૨૩ તથા ના.વ. ૨૦૨૩-૨૪માં આગળ કેરીઇંગ/(હોલ્ડિંગ) કોસ્ટ	(૧.૫૪)
ના.વ. ૨૦૨૩-૨૪ સંકલિત મહેસૂલી ખાધ/(પુરાંત)	(૫૦.૮૪)

ના.વ. ૨૦૨૫-૨૬થી ના.વ. ૨૦૨૯-૩૦ સુધી નિયંત્રિત સમયગાળા માટે સંકલિત મહેસૂલ આવશ્યકતા (એઆરઆર)

- અરજદારના પરવાના વિસ્તાર માટે સંકલિત મહેસૂલ આવશ્યકતા જીઈઆરસી (એમવાયટી) નિયમન ૨૦૨૪ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓને આધારે ગણતરી કરાઈ છે. અરજદારે નીચે મુજબ ના.વ. ૨૦૨૫-૨૬થી ના.વ. ૨૦૨૯-૩૦ સુધી નિયંત્રિત સમયગાળા માટે એઆરઆર સુપરત કર્યું છે:

કોષ્ટક ૩: ના.વ. ૨૦૨૫-૨૬થી ના.વ. ૨૦૨૯-૩૦ સુધી નિયંત્રિત સમયગાળા માટે એઆરઆર
(રૂ. કરોડમાં)

માપદંડ	૨૦૨૫-૨૬	૨૦૨૬-૨૭	૨૦૨૭-૨૮	૨૦૨૮-૨૯	૨૦૨૯-૩૦
વીજળીની ખરીદીનો ખર્ચ	૧,૩૯૮.૬૮	૩,૮૨૮.૯૭	૫,૪૭૯.૩૫	૫,૫૨૦.૨૭	૭,૪૧૦.૪૨
ઓ એન્ડ એમનો ખર્ચ	૧૬.૯૨	૨૬.૪૨	૨૮.૯૩	૨૯.૪૬	૩૦.૦૧
ઘસારો	૮.૮૨	૩૫.૨૩	૩૭.૬૯	૩૭.૭૩	૭૬.૮૪
વ્યાજ અને ફાયનાન્સ ખર્ચ	૩.૯૦	૩.૨૯	૨.૬૮	૨.૦૭	૧.૪૫
સીક્યુરીટી ડીપોઝિટ ઉપરનું વ્યાજ	૦.૭૨	૦.૭૨	૦.૭૨	૦.૭૨	૦.૭૨
કાર્યકારી મૂડી ઉપરનું વ્યાજ	૧૨.૦૪	૩૨.૪૪	૪૫.૬૮	૪૬.૦૬	૬૭.૬૧
ઘાલખાધની જોગવાઈ	-	-	-	-	-
કન્ટીન્જન્સી રીઝર્વ	-	-	-	-	-
મહેસૂલી ખર્ચ	૧,૪૪૧.૦૮	૩,૯૨૭.૦૭	૫,૫૯૫.૦૪	૫,૬૩૬.૩૧	૭,૫૮૭.૦૫
ઇક્વિટી મૂડી ઉપરનું વળતર	૫.૯૪	૫.૯૪	૫.૯૪	૫.૯૪	૫.૯૪
રોકવામાં આવેલી આવકની મૂડી	૨૬.૮૬	૬૧.૧૦	૬૮.૨૨	૬૬.૪૧	૧૧૫.૨૧
કુલ રેવન્યુ ખર્ચ	૧,૪૭૩.૮૭	૩,૯૯૪.૧૧	૫,૬૬૯.૨૦	૫,૭૦૮.૬૫	૭,૭૦૮.૨૧
બાદ: ટેરિફ સિવાયની આવક	૨૬.૭૮	-	-	-	-
ઓછા: વ્હીલિંગ શુલ્કમાંથી આવક	૧.૫૭	૩૯.૮૨	૫૪.૭૫	૫૩.૫૬	૫૭.૮૩
મહેસૂલી આવકની કુલ જરૂરિયાત	૧,૪૪૫.૫૨	૩,૯૫૪.૨૯	૫,૬૧૪.૪૬	૫,૬૫૫.૦૯	૭,૬૫૦.૩૮

મહેસૂલી ખાધ/પુરાંત)

- હાલના દરોએ ના.વ. ૨૦૨૫-૨૬ માટે અંદાજિત મહેસૂલી આવક રૂ. ૧,૪૩૭.૮૫ કરોડની થાય છે, જેની સામે અંદાજિત એઆરઆર રૂ. ૧,૪૪૫.૫૨ કરોડની છે.
- અરજદારે ના.વ. ૨૦૨૫-૨૬ માટેની અંદાજિત મહેસૂલી ખાધ/પુરાંત) નક્કી કરવા માટે ના.વ. ૨૦૨૩-૨૪ની સંકલિત મહેસૂલી ખાધની સાથે તેની ના.વ. ૨૦૨૩-૨૪ની સુધીની સંકલિત ખાધ ઉપરની હોલ્ડિંગ કોસ્ટ પણ ગણતરીમાં લીધી છે. આ રીતે, ના.વ. ૨૦૨૫-૨૬ માટેની અંદાજિત મહેસૂલી ખાધ રૂ. ૪૩.૧૭ કરોડ થશે. જે અહીં નીચેના કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે:

કોષ્ટક ૪: હાલના દરે ના.વ. ૨૦૨૫-૨૬ માટેની મહેસૂલી ખાધ/પુરાંત)

(રૂ. કરોડમાં)

વિગતો	ના.વ. ૨૦૨૫-૨૬
ના.વ. ૨૦૨૫-૨૬ માટેની અંદાજિત એઆરઆર	૧,૪૪૫.૫૨
ઉમેરો: ના.વ. ૨૦૨૩- ૨૫ માટેની સંકલિત મહેસૂલી ખાધ/પુરાંત)	(૪૯.૩૦)
ઉમેરો: ના.વ. ૨૦૨૩-૨૪ સુધી સંકલિત કેરિઈંગ/(હોલ્ડિંગ) ખર્ચ	(૧.૫૪)
હાલના દરે ના.વ. ૨૦૨૫-૨૬ માટેની અંદાજિત મહેસૂલી આવક	૧,૪૩૭.૮૫
ના.વ. ૨૦૨૫-૨૬ માટેની મહેસૂલી ખાધ/પુરાંત)	(૪૩.૧૭)

ના.વ. ૨૦૨૫-૨૬ માટેની દરની દરખાસ્ત

- ના.વ. ૨૦૨૫-૨૬ માટેની અંદાજિત મહેસૂલી ખાધ હાલના દરે અંદાજે ૨,૪૭૦ એમયુના વેચાણ સામે રૂ. ૪૩.૧૭ કરોડની રહેશે. જોકે ૫,૯૦૮ એમયુના ધારેલા વેચાણ માટે મોજૂદ દરસૂચિએ ના.વ. ૨૦૨૬-૨૭નું દર્શાવેલું મહેસૂલ

અંતર રૂ. ૩૦૮.૫૨ કરોડ તારવવામાં આવ્યું છે. આથી ના.વ. ૨૦૨૫-૨૬ માટે રૂ. ૪૭.૧૩ કરોડની અંદાજિત મહેસૂલ સરપ્લસના સમાયોજન પછી ના.વ. ૨૦૨૬-૨૭ માટે સંકલિત મહેસૂલી ખાદ્ય રૂ. ૨૬૫.૩૫ કરોડ રહેશે.

- ઉક્ત ધ્યાનમાં લેતાં અરજદાર ગ્રાહકોની સર્વ શ્રેણીઓ માટે મોજૂદ દરસૂચિ ચાલુ રાખવાનો પ્રસ્તાવ રાખે છે.

ના.વ. ૨૦૨૫-૨૬ માટેની દરની દરખાસ્ત

- અરજદાર નીચે મુજબ ૧લી એપ્રિલ, ૨૦૨૫ થી અમલ સાથે પ્રસ્તાવિત ટેરિફ ધરાવે છે:

કોષ્ટક પ: એમયુએલના પરવાના વિસ્તાર માટેની દર સૂચિ

ક.નં.	કેટેગરી	ફિક્સ્ડ ચાર્જીસ	એનર્જી ચાર્જ	
૧	રહેઠાણ	ફિક્સ્ડ ચાર્જ સિંગલ ફેઝ સપ્લાય દર મહિને દરેક ઇન્સ્ટોલેશન દીઠ રૂ. ૩૦/- થ્રી ફેઝ સપ્લાય દર મહિને દરેક ઇન્સ્ટોલેશન દીઠ રૂ. ૪૫/-	પહેલા ૨૫૦ યુનિટ	૪૨૦ પૈસા/યુનિટ
			બાકીના યુનિટ	૪૭૦ પૈસા/યુનિટ
		બીપીએલ ઘરગથ્થુ ગ્રાહકો માટે દર મહિને દરેક ઇન્સ્ટોલેશન દીઠ રૂ. ૫/-	પહેલા ૫૦ યુનિટ	૨૫૦ પૈસા/યુનિટ
			બાકીના યુનિટ	રહેણાંક મુજબ
૨	કોમર્સિયલ નોન ડીમાન્ડ (૬ કેવીએ સુધી કનેક્ટેડ લોડ)	સિંગલ ફેઝ સપ્લાય દર મહિને દરેક ઇન્સ્ટોલેશન દીઠ રૂ. ૧૦૦/-	પહેલા ૧૫૦ યુનિટ	૪૭૦ પૈસા/યુનિટ
			બાકીના યુનિટ	૪૮૫ પૈસા/યુનિટ
૩	કોમર્સિયલ ડીમાન્ડ (૬ કેવીએ અને તેથી વધુ કનેક્ટેડ લોડ)	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. પર ૧૦૦% લોડ ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર અથવા ૬ કેવીએ, જે પણ વધુ હોય તે મુજબ માસિક ધોરણે) ૭૫ પૈસા/યુનિટ કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ ૧૨૫ પૈસા/યુનિટ	સમગ્ર વપરાશ	૩૭૦ પૈસા/યુનિટ
૪	ઇન્ડસ્ટ્રીયલ નોન ડીમાન્ડ (૬ કેવીએ સુધી કનેક્ટેડ લોડ)	સિંગલ ફેઝ સપ્લાય દર મહિને દરેક ઇન્સ્ટોલેશન દીઠ રૂ. ૧૦૦/-	પહેલા ૧૫૦ યુનિટ	૪૪૫ પૈસા/યુનિટ
			બાકીના યુનિટ્સ	૪૭૦ પૈસા/યુનિટ
૫	ઇન્ડસ્ટ્રીયલ ડીમાન્ડ (૬ કેવીએ અને તેથી વધુ કનેક્ટેડ લોડ)	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. પર ૧૦૦% લોડ ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર અથવા ૬ કેવીએ, જે પણ વધુ હોય તે મુજબ માસિક ધોરણે)	સમગ્ર વપરાશ	૩૭૦ પૈસા/યુનિટ

		૭૫ પૈસા/યુનિટ કોન્ટ્રાક્ટ ડીમાન્ડની વધુ ૧૨૫ પૈસા/યુનિટ		
૬	સ્ટ્રીટ લાઇટ્સ		સમગ્ર વપરાશ	૪૨૦ પૈસા/યુનિટ
૭	ટેમ્પરરી ડીમાન્ડ	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. પર ૧૦૦% લોડ ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર, જે પણ વધુ હોય તે મુજબ માસિક ધોરણે) ૭૫ પૈસા/યુનિટ કોન્ટ્રાક્ટ ડીમાન્ડની વધુ ૧૨૫ પૈસા/યુનિટ	સમગ્ર વપરાશ	૪૪૫ પૈસા/યુનિટ
૮	એલટી-ઇલેક્ટ્રીક વેહિકલ (ઇવી) ચાર્જિંગ સ્ટેશન	દર મહિને દરેક ઇન્સ્ટોલેશન દીઠ રૂ. ૨૫/-	સમગ્ર વપરાશ	૪૧૫ પૈસા/યુનિટ
૯	એચટીએમડી-I	એ) ગ્રાહકની બિલિંગ ડીમાન્ડ, જે ૧) ૫૦૦ કેવીએ સુધીની કોન્ટ્રાક્ટ ડીમાન્ડ ધરાવે છે (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. પર ૧૦૦% લોડ ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર, જે પણ વધુ હોય તે મુજબ એક સો કેવીએ માસિક ધોરણે) ૭૫ પૈસા/યુનિટ ૨) ૫૦૦ કેવીએથી વધુની કોન્ટ્રાક્ટ ડીમાન્ડ ધરાવે છે (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. પર ૧૦૦% લોડ ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર, જે પણ વધુ હોય તે મુજબ માસિક ધોરણે) ૧૧૦ પૈસા/યુનિટ બી) કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ ૧) ૫૦૦ કેવીએ સુધીની કોન્ટ્રાક્ટ ડીમાન્ડ ૧૨૫ પૈસા/યુનિટ ૨) ૫૦૦ કેવીએથી વધુની કોન્ટ્રાક્ટ ડીમાન્ડ ૧૫૦ પૈસા/યુનિટ	૫૦૦ કેવીએ સુધીની કોન્ટ્રાક્ટ ડીમાન્ડ	૪૧૦ પૈસા/યુનિટ
			૫૦૦ કેવીએ સુધીની કોન્ટ્રાક્ટ ડીમાન્ડ	૪૫૦ પૈસા/યુનિટ
૧૦	એચટીએમડી-II	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર, જે પણ વધુ હોય તે મુજબ એક સો કેવીએ માસિક ધોરણે) ૧૦૦ પૈસા/યુનિટ કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ ૧૫૦ પૈસા/યુનિટ	સમગ્ર વપરાશ	૫૪૫ પૈસા/યુનિટ

૧૧	એચટીએમડી-III	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ (ગણતરી માસિક ધોરણે કોન્ટ્રાક્ટ ડીમાન્ડના ૮૫% યુ.પી.એફ. પર ૧૦૦% લોડ ફેક્ટર અથવા તો વાસ્તવિક વધુમાં વધુ ડીમાન્ડ માસિક એવરેજ પાવર ફેક્ટર, જે પણ વધુ હોય તે મુજબ એક સો કેવીએ માસિક ધોરણે) ૭૫ પૈસા/યુનિટ કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ ૧૨૫ પૈસા/યુનિટ	સમગ્ર વપરાશ	૩૭૦ પૈસા/યુનિટ
૧૨	એચટીએમડી-IV	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ રૂ. ૨૫ પ્રતિ કેવીએ દર મહિને કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ રૂ. ૫૦ પ્રતિ કેવીએ દર મહિને	સમગ્ર વપરાશ	૩૭૦ પૈસા/યુનિટ
૧૩	એચટી-ઇલેક્ટ્રીક વેહિકલ (ઇવી) ચાર્જિંગ સ્ટેશન્સ	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ રૂ. ૧૮૦ પ્રતિ કેવીએ દર મહિને કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ રૂ. ૪૨૫ પ્રતિ કેવીએ દર મહિને	સમગ્ર વપરાશ	૪૧૦ પૈસા/યુનિટ
૧૪	રેલવે ટ્રેક્શન	કોન્ટ્રાક્ટ ડીમાન્ડ સુધી અને સહિતની બિલિંગ ડીમાન્ડ રૂ. ૧૮૦ પ્રતિ કેવીએ દર મહિને કોન્ટ્રાક્ટ ડીમાન્ડથી વધુ રૂ. ૪૨૫ પ્રતિ કેવીએ દર મહિને	સમગ્ર વપરાશ	૫૮૦ પૈસા/યુનિટ

નોંધ:

૧ પાવર ફેક્ટર એડજસ્ટમેન્ટ ચાર્જીસ - કોમર્સિયલ ડીમાન્ડ આધારિત, ઇન્ડસ્ટ્રીયલ ડીમાન્ડ આધારિત, એચટીએમડી-I, એચટીએમડી-II, એચટીએમડી-III, એચટીએમડી-IV તથા રેલવે ટ્રેક્શનને લાગુ પડે છે.

પાવર ફેક્ટરમાં દરેક ૧% ના સુધારા દીઠ રીબેટ આપવામાં આવે છે.

પાવર ફેક્ટર ૮૦% થી ૮૫% - ૦.૧૫ પૈસા/યુનિટ

પાવર ફેક્ટર ૮૫% થી વધુ - ૦.૨૭ પૈસા/યુનિટ

પાવર ફેક્ટરમાં દરેક ૧% ના ઘટાડા માટે દંડ વસૂલ કરવામાં આવે છે.

પાવર ફેક્ટર ૮૦% થી ઓછો - ૩.૦૦ પૈસા/યુનિટ

૨ એફપીપીએએસ ચાર્જીસ - લાગુ પડતા હોય તે મુજબ

૩ એચટીએમડી-I, એચટીએમડી-II, એચટીએમડી-III, એચટીએમડી-IV તથા રેલવે ટ્રેક્શનને ઇએચવી ખાતે સપ્લાય માટે રીબેટ આ મુજબ અપાય છે:

એનર્જી ચાર્જીસ ઉપર		રીબેટ
૧	સપ્લાય ૧૧ કેવી હોય તો	૦.૦%
૨	સપ્લાય ૩૩ કેવી હોય તો	૧.૦%
૩	સપ્લાય ૬૬ કેવી અને વધુ હોય તો	૨.૦%

નોંધ: ઉપરોક્ત રીબેટ ફક્ત માસિક ધોરણે લાગુ પડશે અને જે ગ્રાહકોના અગાઉના બિલના લેણા પડતર હશે, તેઓ ઉપરોક્ત રીબેટ મેળવવાને પાત્ર નહીં ગણાય, જો કે, જે ગ્રાહકોના બાકી લેણાની વસૂલાત સાથે યોગ્ય અધિકારી/કોર્ટ દ્વારા મનાઈકમ ફરમાવાયો હોય તેમને લાગુ પડતો રીબેટ અપાશે.

૧૫	ગ્રીન ટેરિફ	- કેડબ્લ્યુએચ દીઠ રૂ. ૧.૦૦નું ગ્રીન ટેરિફ, જે ટેરિફ આદેશ અનુસાર સંબંધિત શ્રેણીના સાધારણ ટેરિફથી ઉપરાંત તેમની માગણીને પહોંચી વળવા માટે ગ્રીન એનર્જી અપનાવનારા ગ્રાહકોને લાગુ કરાશે. - સર્વ ગ્રાહકો (એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ) ગ્રીન પાવર ટેરિફની ચુકવણી પર આરઈ પાવર અપનાવવા માટે પાત્ર રહેશે. - આ વિકલ્પ બિલિંગના સમયગાળાના આરંભ પૂર્વે લેખિતમાં વિતરણ લાઈસન્સીને બિલિંગ ચક્રની સૂચના આપીને ગ્રાહકો દ્વારા અજમાવી શકાય છે.
----	-------------	--